

The joy that is contained in activity is compensated and balanced by the perhaps still greater joy contained in withdrawal from all activity; when the two states alternate in the being or are even simultaneously conscious, the felicity is complete, for then, O Lord, Thy plenitude is realized.

O divine Master, Thou hast granted to me the infinitude of divine contemplation, the perfect calm of Thy Eternity, and through an identification with our divine Mother, the All-Realiser, Thou hast permitted me to participate in her sovereign power to be conscious and active...

In the omnipotent bliss of Thy infinitude, I bow to Thee!
— The Mother

અમને પ્રવૃત્તિમાં જો આનંદ મળી રહ્યો છે, તો એની સામે કદાચ એ કરતાં પણ વિશેષ આનંદ સર્વ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવામાં પણ મળી આવે છે. આ બંને આનંદ એક બીજા સામે તોળાઈ રહ્યા છે. આ બંને સ્થિતિઓ માણસમાં જ્યારે વારાફરતી આવતી થઈ જાય છે અથવા તો એ જ્યારે એકી સાથે અનુભવાય છે ત્યારે આનંદની પૂર્ણતા રચાય છે. કારણ કે, એ સ્થિતિમાં, પ્રભુ, તારી પૂર્ણ સમૃદ્ધિનો અમને સાક્ષાત્કાર થતો હોય છે.

હે દિવ્ય ગુરુ, તારા દિવ્ય ચિંતનોની અનંતતા તેં મને બક્ષી છે, તારી શાશ્વતીની પૂર્ણ શાંતિ તેં મને આપી છે. અમારાં દિવ્ય મા ભગવતી સાથે, એ સર્વ દિવ્ય સિદ્ધિઓની દાત્રી સાથે મારું તાદાત્મ્ય રચી આપ્યું છે અને એ રીતે તેં મને વરદાન આપ્યું છે કે હું સચેતન અને સક્રિય રીતે એની પરમ શક્તિમાં સહભાગી બની શકીશ...

તારી અનંતતાના સર્વ સમર્થ આનંદમાં હું તને પ્રણામ કરું છું !

— શ્રી માતાજી

Prayers and Meditations - October 8, 1914 / પ્રાર્થનાઓ અને ધ્યાન - ૮ ઓક્ટોબર ૧૯૧૪

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. ©0413-2331470
સ્વાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨. ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • December 2017



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2017
DECEMBER
૧ ડિસેમ્બર, ૨૦૧૭

— Thou Shalt Grant ... Thou Hast Granted —
— તું આપશે ... તેં આપ્યું છે —

*Whatever we do, we
must always remember
our aim,
with blessings*

Whatever we do, we must always remember our aim.

With Blessings.
— The Mother

આપણે જે કાંઈ કરીએ, આપણું લક્ષ્ય હમેશાં યાદ રાખવું જોઈએ.

આશીર્વાદ સાથે
— શ્રી માતાજી

Mantras of the Mother - 7 December 1954 / શ્રી માતાજીના મંત્રો - ૭ ડિસેમ્બર ૧૯૫૪

At the rising of the sun I sang the praise of this world in which it is possible not only to desire Thee but to know Thee and even to become Thee. And I was astonished that there should be some who so ardently aspire to leave this universe and enter another world of perfection.

Thou hast placed such contentment in my heart that it has become impossible for me not to feel satisfied in all circumstances, inner or outer. And yet something in my being always aspires for more beauty, for more light, for more knowledge, for more love – in a word, for a more conscious, a more constant relation with Thee.... But this too depends upon Thy will, and when it is Thy will, Thou shalt grant me the entire transfiguration.

-The Mother

સૂર્યની ઉદયવેળાએ, મેં આ જગતનાં સ્તુતિ-ગાન કર્યાં કે જેમાં તારે માટે ઇચ્છા કરવી એટલું જ માત્ર શક્ય નથી, પરંતુ તને જાણવો અને તારા સ્વરૂપે બની રહેવું એ પણ શક્ય છે. અને મને આશ્ચર્ય થયું કે કેટલાક લોકો પૂર્ણતાના બનેલા એક બીજા જગતમાં જવા માટે આ વિશ્વને તજી દેવાની અત્યંત આતુર ભાવે અભીપ્સા કરતા રહે છે.

તેં મારા હૃદયમાં એટલી બધી તો તૃપ્તિ મૂકી દીધી છે કે સર્વ સંયોગોમાં, આંતર તેમજ બાહ્ય, મારે સંતુષ્ટ ન રહેવું એ અશક્ય બની ગયું છે. અને છતાં મારા સ્વરૂપમાં રહેલું કાંઈક વધુ સૌન્દર્ય માટે, વધુ પ્રકાશ, વધુ જ્ઞાન, વધુ પ્રેમ માટે, ટૂંકમાં કહીએ તો, તારી સાથે એક વધુ સભાન અને વધુ સતત સંબંધ માટે અભીપ્સા સેવી રહું છું ... પરંતુ એનો આધાર પણ તારી ઇચ્છા ઉપર રહે છે અને તારી ઇચ્છા જ્યારે થશે ત્યારે તું મને રૂપાંતર આપશે.

- શ્રી માતાજી

O My sweet Master, eternal splendour, I can only unite with Thee in silence and peace, saying that Thy Will may be done in every detail as in the whole. Take possession of Thy kingdom, master all that revolts against Thee, heal the souls who do not know Thee and the intellects that do not want to submit and be consecrated to Thee. Awaken our slumbering energies, stimulate our courage, enlighten us, O Lord, show us the Way.

My heart is overflowing with a sovereign peace, my thought is calm and silent.

At the core of all that is, of all that will be, of all that is not, is Thy divine and unchanging smile.

- The Mother

હે મારા મધુર ગુરુ, શાશ્વત પ્રભા, હું તો માત્ર તારી સાથે નીરવતામાં અને શાંતિમાં મારી જાતને જોડી લઈ શકું છું, કહેતાં ‘તારી ઇચ્છા વિગતોની અંદર તેમ જ સમગ્રની અંદર સિદ્ધ થાઓ.’ આમ, તારા રાજ્યનો કબજો તું લઈ લે, તારી સામે જે કાંઈ બંડ કરતું હોય તેને વશ કરી લે, જે આત્માઓ તને જાણતા નથી અને જે બુદ્ધિઓ તને વશ થવા માટે તથા સમર્પિત થવા માટે ના પાડે છે તેમને સભાન કર, સૂતેલી શક્તિઓને જાગૃત કર, હિંમતને પ્રોત્સાહિત કર, અમને પ્રબુદ્ધ કર, પ્રભુ, અમને માર્ગ બતાવ.

હૃદય એક પરમ શાંતિથી છલકાઈ રહ્યું છે, મન સ્વસ્થ અને નીરવ છે.

જે કાંઈ અસ્તિત્વમાં છે, જે કાંઈ થવાનું છે, જે કાંઈ અસ્તિત્વમાં છે નહિ તે સર્વની પાછળ તારું દિવ્ય અને સુસ્થિર સ્મિત આવેલું છે.

- શ્રી માતાજી